

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટન COVID-19નો ફેલાવો રોકવા શારીરિક ડિસ્ટન્સિંગની અમલબજાવણી કરાવવા માટે બાય-લૉ લાવ્યા છે જેમાં દરેક ગુના માટે \$1,00,000 ની ફાઈનનો સમાવેશ થાય છે.

બ્રેમ્પટન, ઓન્ટારિયો (31 માર્ચ 2020) – આજે રહેવાસીઓના આરોગ્ય અને સલામતીના રક્ષણ માટે મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown) દ્વારા બ્રેમ્પટન COVID-19 ઈમર્જન્સી મેજર્સ બાય-લૉ પર સહી કરવામાં આવી છે. 25 માર્ચ 2020ના રોજ થયેલ કાઉન્સિલની વિશિષ્ટ બેઠકમાં સિટી કાઉન્સિલે સ્ટાફને બાય-લૉની અમલ બજાવણીમાં કરેલ વધારાને તપાસવાના નિર્દેશ આપ્યા છે.

નવીન બાય-લૉ અમુક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ ફરમાવે છે અને સમાજમાં COVID-19નો ફેલાવો રોકવામાં મદદ મળે તે માટે શારીરિક ડિસ્ટન્સિંગનું નિયમન કરે છે. જે વ્યક્તિઓ શારીરિક ડિસ્ટન્સિંગ નિયમનનો ભંગ કરે તેઓને પ્રત્યેક ગુના માટે ઓછામાં ઓછા \$500 અને મહત્તમ \$1,00,000 ફાઈન કરવાની જોગવાઈ છે.

બાય-લૉ હેઠળના સુધરાઈના નિયમોમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

- લોકોને કોઈપણ જાહેર મિલકત પર એક બીજાથી 2.0 મીટરથી ઓછું અંતર જાળવવા (સિવાયકે જે લોકો સાથે તેઓ નિવાસ કરતા હોય) પર પ્રતિબંધ.
- વ્યવસાયો, વ્યવસાયની અંદર અથવા બહાર લોકોને (સિવાયકે જે લોકો સાથે તેઓ નિવાસ કરતા હોય) 2.0 મીટરથી ઓછા અંતરે રહેવાની મંજૂરી આપવા પર પ્રતિબંધ પછી તેઓ ઊભા હોય કે બેઠા હોય;
- નીચે આપેલ કોઈપણ સિટીની મિલકતોનો ઉપયોગ લોકો કરે તેના પર પ્રતિબંધ:
 - સમતના મેદાન અને પાર્કમાં રહેલ અન્ય બાંધકામો;
 - લીશ-ફી ડોંગ પાર્ક;
 - પિકનિક શેલ્ટરો;
 - આઉટડોર સ્પોર્ટ્સ સવલતો અને આઉટડોર ફિટનેસ સાધનો જેમાં સામેલ છે બાસ્કેટ બૉલ અને ટેનિસ કોર્ટ્સ;
 - રિક્રિએશન સેન્ટરો અને તેની આસપાસની જમીન; અને
 - પાર્કિંગ લોટ્સ

સિટી બ્રેમ્પટનવાસીઓને માહિગાર રાખવા પ્રતિબદ્ધ છે અને ઉપલબ્ધ થતા જશે તેમ તેમ COVID-19 સામે સિટી દ્વારા લેવામાં આવેલ પગલાં વિશે અપડેટ્સ આપવાનું ચાલુ રાખશે. COVID-19ને પ્રતિસાદ આપતા સમાજને સપોર્ટ કરવાના સિટીના પ્રયાસો તેમજ ઉપરોક્ત નિર્ણયો વિશે વધુ માહિતી માટે, મુલાકાત લો www.brampton.ca/COVID19 અથવા @CityBrampton ને [Twitter](https://twitter.com/CityBrampton), [Facebook](https://facebook.com/CityBrampton) અને [Instagram](https://instagram.com/CityBrampton) પર ફોલો કરો.

હકિકતોનો ટૂંકસાર

- 25 માર્ચ 2020ના રોજ થયેલ COVID-19 ટેલિ ટાઉન હોલમાં આશરે 1,200 નિવાસીઓ પૈકી 76 ટકા લોકોએ મતદાન મારફતે સૂચિત કર્યું કે જે લોકો શારીરિક ડિસ્ટન્સિંગ ન જાળવતા હોય તેઓ પાસેથી સિટીનો સ્ટાફ દંડ વસૂલે તેને તેઓ સમર્થન આપે છે.
- 27 માર્ચ 2020ના રોજ પ્રોવિન્સ ઓફ ઓન્ટારિયોએ સુધારિઓને સલાહ આપી કે તેઓએ એવો કાયદો બનાવ્યો છે જેથી સિટીના મ્યુનિસિપલ લો એન્ફોર્સમેન્ટ અધિકારીઓ ઈમર્જન્સી મેનેજમેન્ટ એન્ડ સિવિલ પ્રોટેક્શન એક્ટ હેઠળ બનાવેલ નિયમોની બજાવણી કરવાની અધિકૃતિ પ્રદાન થાય.
- માર્ચ 26ના દિનથી બ્રેમ્પટન ખાતેના તમામ 500 કરતા વધુ રમતના મેદાનો જાહેર જનતા માટે આગામી સૂચના આવે ત્યાં સુધી બંધ રહેશે.
- તાજેતરમાં, COVID-19નો ફેલાવો રોકવાના પ્રયાસ તરીકે વ્યવસાયોને અનિવાર્ય અને બિન-અનિવાર્ય તરીકે નિયુક્ત કરતો કાયદો પસાર થયો હતો.
 - જો નિવાસીઓએ આનું પાલન ન કરતા વ્યવસાય, કે સિટીની માલિકીની બંધ કરેલ સવલતોનો ઉપયોગ થતો જણાય (સિવાયકે બિન-અનિવાર્ય સેવાઓ) અથવા પાંચ કરતા વધુ લોકો ભેગા થયેલ જણાય તો તેઓને 311 પર કોલ કરવા જણાવવામાં આવે છે. બાય-લો એન્ફોર્સમેન્ટ ઓફિસર અને/અથવા સિક્યોરિટી કર્મચારી ફરિયાદની તપાસ કરી અનુપાલન સુનિશ્ચિત કરશે અને ઉચિત હશે ત્યાં ગુનો નોંધશે.
 - જો નિવાસીઓએ બિન-અનુપાલન કરતી ફૂડ એસ્ટાબ્લિશમેન્ટ જેમકે બાર અથવા રેસ્ટોરન્ટની ફરિયાદ કરવી હોય તો તેઓએ પીલ પબ્લિક હેલ્થને 905.799.7700 પર ફોન કરીને જાણકારી આપવી.

અવતરણો

"સિટી ઓફ બ્રેમ્પટન માટે આપણા રહેવાસીઓના આરોગ્ય અને સલામતી હંમેશા અગ્રીમ રહી છે અને તે પન ખાસ તો આવા સમયે. આપણે સહુએ COVID-19ની ગંભીરતા સમજીને સાથે કાર્ય કરવાનું છે જેથી એનો ફેલાવો ઓછામાં ઓછો થાય. સિટી એવા દરેક પગલાં લેવા ચાલું રાખશે જે આપણા સમાજને સલામત રાખવા માટે આવશ્યક હોય. હું તમામ રહેવાસીઓને બ્રેમ્પટન COVID-19 ઈમર્જન્સી મેજર્સ બાય-લોનું પાલન કરવા અને શારીરિક ડિસ્ટન્સિંગ જાળવવા અપીલ કરું છું."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સિટી ઓફ બ્રેમ્પટન

અમલબજાવણી મારફત બ્રેમ્પટન COVID-19 ઈમર્જન્સી મેજર્સ બાય-લો કર્મચારીઓને આપણા સમુદાયોમાં શારીરિક ડિસ્ટન્સિંગ પ્રોત્સાહિત કરવાની COVID-19ના ફેલાવાને નિયંત્રિત કરવાના પ્રયાસ તરીકે મંજૂરી આપશે. સિટી સ્ટાફ, રહેવાસીઓના આરોગ્ય અને સલામતીની સુરક્ષા માટે જરૂરી હોય એવા કોઈપણ પગલા લેવાનું ચાલું રાખશે."

- ડેવિડ બાર્રિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ



Media Release

છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા દુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca